

16 એપ્રિલ 2018

## બ્રમ્પટન અને યોર્ક રિજન માટે ઇલેક્ટ્રિક બસ પાયલટ પરિયોજના માટેનું ભંડોળ જાહેર થયું

બ્રમ્પટન, ઓન્ટારિયો – માનનીય સ્ટીવન ડેલ ડુકા (Steven Del Duca), આર્થિક વિકાસ અને સંવર્ધન મંત્રીએ, આજે બ્રમ્પટન અને યોર્ક રિજનમાં વિદ્યુત-સંચાલિત બસો તપાસવા માટે નવી પાયલટ પરિયોજના માટે ભંડોળ જાહેર કર્યું. જાહેરાત ન્યુમાર્કેટ પર સ્થિત યોર્ક રિજન એડમિનિસ્ટ્રેટિવ સેન્ટર (York Region Administrative Centre) ખાતે કરવામાં આવી.

બ્રમ્પટન ટ્રાન્ઝિટ [કેનેડિયન અર્બન ટ્રાન્ઝિટ રિસર્ચ એન્ડ ઇનોવેશન કન્સોર્ટિયમ \(CUTRIC\)](#), સાથેની ભાગીદારીમાં 2015થી આજ સુધી આ અજમાયશના આયોજન અને અમલમાં અગ્રણી ટ્રાન્ઝિટ એજન્સી તરીકે કાર્ય કરે છે. આ રાષ્ટ્રીય અજમાયશ [વિશ્વમાં આ પ્રકારની પ્રથમ કન્સોર્ટિયમ આધારિત પરિયોજના](#) છે.

2019માં બ્રમ્પટન માનકીકૃત અને સંપૂર્ણપણે આંતરપ્રચાલિત વિદ્યુત બસો તેમજ ઉચ્ચ વિદ્યુત પ્રવાહ સંચાલિત ઓવરહેડ ઓનરૂટ ચાર્જિંગ સિસ્ટમ અને સૌથી વિશાળ વ્યાપક વ્યુહરચના ધરાવશે; જેની સાથે હશે આઠ ઇલેક્ટ્રિક બસો (છ ન્યુ ફ્લાયર ઇન્ડસ્ટ્રિઝની અને બે નોવા બસની) અને ચાર ચાર્જિંગ સિસ્ટમ્સ (ABBગ્રૂપની ત્રણ અને એક સિમેન્સની) હશે.

ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સેવા જે સીટીની એકંદર કાર્બન ફુટપ્રિન્ટ અને ગ્રીનહાઉસ ગેસ એમિઝન્સ (GHG) ઘટાડતી હોય તે પૂરું પાડવા માટે નવા અને પ્રવર્તનાત્મક ઉકેલો આપવા માટે બ્રમ્પટન ટ્રાન્ઝિટ પ્રતિબદ્ધ છે.

બ્રમ્પટન ટ્રાન્ઝિટ હાલમાં તેમની ફ્લીટમાં 110 ઝૂમ બસ રેપિડ ટ્રાન્ઝિટ વેહિકલ્સ (Züm bus rapid transit vehicles) સહિત 422 બસ ચલાવે છે. સંપૂર્ણ ડિઝલ જેવા ઈંધણ પર ચાલતા વાહન સાથે સરખામણી કરીએ તો ઝૂમ બસ ડિઝલ-હાયબ્રિડ ઇલેક્ટ્રિક હોય છે જે આશરે 3,500 જેટલા ટન GHGનો વર્ષ દીઠ ઘટાડો કરે છે.

2017માં, બ્રમ્પટન ટ્રાન્ઝિટની સવારીઓ અગાઉના વર્ષની સરખામણીએ અને તેની વૃદ્ધિના આધારે જોતા 18% વધી, 2031 સુધીમાં તેની ફ્લીટ 800 વાહનોની સંખ્યા આંખી જશે એવી અપેક્ષા રાખવામાં આવે છે.

### ક્યોટ:

ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સેવા જે સીટીની એકંદર કાર્બન ફુટપ્રિન્ટ અને GHG એમિઝન્સ ઘટાડતી હોય તે પૂરી પાડવા બ્રમ્પટન ટ્રાન્ઝિટ નવા અને પ્રવર્તનાત્મક ઉકેલો આપવાનું ચાલું રાખે છે. બ્રમ્પટન કેનેડાના ઇનોવેશન સુપર કોરિડોર પર સ્થિત હોવાથી આપણી સરસ રીતે જોડાયેલ ટ્રાન્ઝિટ નેટવર્ક અને ટકાઉ ફ્લીટ GTHAના એક છેરેથી બીજા છેડે લોકોને વધુ કાર્યક્ષમ રીતે લઈ જાય તે અગત્યનું છે. નવી ઈ-બસ પ્રમાણિત કરે છે કે સીટી ઓફ બ્રમ્પટન ભવિષ્ય માટે સજ્જ છે."

- મેયર લિન્ડા જૈફી

"બ્રેમ્પટન ટ્રાન્ઝિટ દ્વારા વિતેલા ઘણાં વર્ષો દરમિયાન અનેક નવી ટેકનોલોજિઓ તેમજ પહેલો રજૂ કરવામાં આવી છે જેથી આપણી સવારીઓને અસાધારણ સેવા આપી શકાય. આ હજુ એક એવી પરિયોજના છે જેમાં અમે નવીન, પ્રવર્તનશીલ ટેકનોલોજિઓ અજમાવતા અમને ગર્વની લાગણી થાય છે જેનાથી અમારી પર્યાવરણીય ફુટપ્રિન્ટમાં તો સુધારો આવશે જ, પરંતુ સાથે અમારા કેનેડાના અગ્રેસર પરિવહન પ્રદાતા બનવાના અમારા પ્રયાસો પણ વિસ્તરશે. અમે આ પ્રોજેક્ટમાં પ્રથમ દિવસથી જ અગ્રણી હોવાનો ગર્વ લઈએ છીએ અને તે આગળ વધે તે જોવા ઉત્સુક છીએ."

- એલેક્સ મિલોજેવિક, જનરલ મેનેજર, બ્રેમ્પટન ટ્રાન્ઝિટ

-30-

**બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે.** અમે તીક્ષ્ણ ફોક્સ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સક્ષમતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તાણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**મીડિયા સંપર્ક (MEDIA CONTACT)**

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | [natalie.stogdill@brampton.ca](mailto:natalie.stogdill@brampton.ca)